

લિબર્ટી પેપરસેટ

ધોરણ 12 : રસાયણ વિજ્ઞાન

Full Solution

સમય : 3 કલાક

અસાઈનમેન્ટ પ્રશ્નપત્ર 10

Part A

1. (D) 2. (C) 3. (D) 4. (C) 5. (B) 6. (B) 7. (B) 8. (A) 9. (A) 10. (A) 11. (D) 12. (B) 13. (C)
14. (B) 15. (B) 16. (B) 17. (C) 18. (B) 19. (D) 20. (D) 21. (D) 22. (B) 23. (D) 24. (C) 25. (A) 26. (D)
27. (D) 28. (C) 29. (A) 30. (D) 31. (D) 32. (C) 33. (B) 34. (A) 35. (C) 36. (C) 37. (D) 38. (A)
39. (C) 40. (B) 41. (C) 42. (B) 43. (B) 44. (B) 45. (C) 46. (B) 47. (D) 48. (A) 49. (B) 50. (C)



Part B

વિભાગ A

➤ નીચે આપેલા પ્રશ્નોના માંગયા મુજબ ઉત્તર આપો : (દરેક પ્રશ્નના રે ગુણ)

1.

$$K = \frac{1}{R} \times \frac{l}{A}$$

$\frac{l}{A}$ = કોષ અચળાંક

$$\therefore \frac{l}{A} = K \cdot R$$

$$= 0.146 \times 10^{-3} \text{ S cm}^{-1} \cdot 1500 \Omega$$

$$\therefore \frac{l}{A} = 0.219 \text{ cm}^{-1}$$

2.

$$k = 2.0 \times 10^{-2}$$

$$[R]_0 = 1 \text{ mol L}^{-1}, t = 100 \text{ sec}$$

$$[R]_t = ?$$

$$k = \frac{2.303}{t} \log \frac{[R]_0}{[R]_t}$$

$$\therefore \log \frac{[R]_0}{[R]_t} = \frac{k \cdot t}{2.303} = \frac{2 \times 10^{-2} \times 100}{2.303} = 0.8684$$

$$\therefore \frac{[R]_0}{[R]_t} = \text{Antilog } 0.8684 = 7.3863$$

$$\therefore [R]_t = \frac{[R]_0}{7.3863} = \frac{1}{7.3863} \text{ mol L}^{-1} = 0.1354 \text{ mol L}^{-1}$$

3.

➤ ર્ઝન્ડિથમ પરમાણુની ધરા અવસ્થામાં $3d$ કક્ષકો અસ્પૂર્ણ ભરાયેલી ($3d^1$) છે, તેથી તેને સંકરાત્મિત તત્ત્વ ગણવામાં આવે છે. જ્યારે બીજુ તરફ જિંક પરમાણુની ધરા અવસ્થામાં તેમજ તેની ઓક્સિડેશન અવસ્થામાં d -કક્ષકો સંપૂર્ણ ભરાયેલી ($3d^{10}$) હોય છે, તેથી તેને સંકરાત્મિત તત્ત્વ ગણવામાં આવતું નથી.

4.

➤ Mn^{2+} ની ઇલેક્ટ્રોન રચના $3d^5$ છે. જે અદ્યપૂર્ણ ભરાયેલ હોવાથી વધુ સ્થાયી છે. પરિણામે તેનો ગીજો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો ન હોવાથી તેની તૃતીય આચનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે હોય છે.

➤ Fe^{2+} ની ઇલેક્ટ્રોન રચના $3d^6$ છે. આથી તે સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના $3d^5$ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે.

➤ આમ, +3 અવસ્થામાં ઓક્સિડેશન પામવા સંદર્ભે Mn^{2+} સંયોજનો Fe^{2+} કરતાં વધારે સ્થાયી હોય છે.

5.

➤ $[Fe(CN)_6]^{4-}$ અને $[Fe(H_2O)_6]^{+2}$ બંને સંકીર્ણમાં Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 છે.

➤ Fe^{2+} ની ઇલેક્ટ્રોનરચના :




➤ $[Fe(CN)_6]^{4-}$ માં CN^- પ્રભળ લિગેન્ડ હોવાથી $3d$ -કક્ષકમાં રહેતાં છ ઇલેક્ટ્રોનનું ચુંઝિકરણ થાય છે. આથી બદાં જ ઇલેક્ટ્રોન ચુંઝિત થાય છે. આથી $d-d$ સંકરણ થતું નથી.

- $[Fe(H_2O)_6]^{+2}$ માં H_2O લિર્બળ લિગેન હોવાથી 3d-કક્ષકમાં રહેતાં ઈલેક્ટ્રોનનું ચુભ્રિકરણ થતું નથી. આથી તેમાં ચાર અયુભ્રિત ઈલેક્ટ્રોન હોય છે. આથી d-d સંકરણ થાય છે.
- આમ, બંને સંકીર્ણમાં અયુભ્રિત ઈલેક્ટ્રોનની સંખ્યામાં તકાવત હોવાથી સંકીર્ણોના મંદ્રાવણ જુદા જુદા રંગના હોય છે.

6.

- Pt નો પરમાણુકમાં 78 છે અને તે 10માં સમૂહનું તત્ત્વ છે.
- Pt ની બાહ્યતમકક્ષાની ઈલેક્ટ્રોન રચના $5d^9 6s^1$ છે.
- $[Pt(CN)_4]^{-2}$ સંકીર્ણ આયનમાં Pt ની ઓક્સિડેશન અવસ્થા +2 છે.
- Pt^{+2} ની ઈલેક્ટ્રોન રચના : $[Ar] 5d^8 6s^0$ છે.
- $[Pt(CN)_4]^{-2}$ સમતલીય ચોરસ બોમિક આકાર ધરાવે છે. આથી તેમાં dsp^2 સંકરણ થાય છે.
- dsp^2 સંકરણ માટે એક 5d કક્ષક ખાતી હોવી જોઈએ, આથી 5d કક્ષકમાં રહેતાં ઈલેક્ટ્રોનનું ચુભ્રિકરણ થાય છે.
- આથી, તેમાં એક પણ અયુભ્રિત ઈલેક્ટ્રોન નથી.





7.

- જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે. તેઓને ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાય છે.”
- સાઇનાઇડ અને નાઇટ્રોએટ જેવાં સમૂહો ઉભયદંતીય કેન્દ્રાનુરાગી છે.
- સાઇનાઇડ સમૂહ બે જુદી જુદી રીતે ${}^{10}\text{C} \equiv \text{N} \leftrightarrow :\text{C} = \text{N}^{\oplus}$ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે.
- સાઇનાઇડ સમૂહનો કાર્બન પરમાણુ સાથે જોડાવાથી આલ્કાઇલ સાઇનાઇડ અને નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાવાથી આઇસોસાઇનાઇડ બનાવે છે.
- નાઇટ્રોએટ સમૂહ પણ જોડાણના બે જુદાં જુદાં થાનો
- $\ddot{\text{O}} - \text{N} = \ddot{\text{O}} : \longleftrightarrow \ddot{\text{O}} = \ddot{\text{N}} = \ddot{\text{O}}$
- ધરાવતો હોવાથી તે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે.
- નાઇટ્રોએટ સમૂહના ઓક્સિજન પરમાણુના જોડાણથી આલ્કાઇલ નાઇટ્રોએટ સંયોજનો અને નાઇટ્રોજન પરમાણુના જોડાણથી નાઇટ્રોઆલ્કેન સંયોજનો બને છે.

8.

- $C_6H_5CHClC_6H_5$ વધારે સરળતાથી KOH વડે જળવિભાજન પામશે.

જલીય




- $C_6H_5CH_2Cl$ માથભિક હેલાઇડ અને $C_6H_5CHClC_6H_5$ હિટીયક હેલાઇડ છે.

- $C_6H_5CH_2Cl$ કરતાં $C_6H_5CHClC_6H_5$ માં રહેતાં બે ફિનાઇલ સમૂહોની સર્પેન્ન અસર વધારે હોવાથી સ્થાયી કાર્બોકિટાયન ($C_6H_5)_2CH^+$ બને છે. આથી, $C_6H_5CHClC_6H_5$ ની જલીય KOH સાથેની જળવિભાજનપ્રક્રિયા સરળ છે.

9.


- આલ્કોહોલ સંયોજનો હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરી આલ્કાઇટ હેલાઇડ સંયોજનો બનાવે છે.



- પ્રોથેય વર્ગના આલ્કોહોલ સંયોજનોની HCl સાથેની પ્રતિક્રિયાત્મકતાના તફાવતને આદારે તેઓને એકળીજાથી અલગ પારખી શકાય છે.
- આલ્કોહોલ સંયોજનો લ્યુકાસ પ્રક્રિયકમાં (સાંક્રાંતિક HCl અને ZnCl_2) દ્વારા થાય છે, જ્યારે તેના હેલાઇડ સંયોજનો અમિન્ધિત હોય છે અને તેઓ દ્રાવણમાં દૂંઘળપણું ઉત્પન્ન કરે છે.
- તૃતીયક આલ્કોહોલ દ્રાવણમાં તરત જ દૂંઘળપણું ઉત્પન્ન કરે છે. કારણકે, તેઓ સરળતાથી હેલાઇડ સંયોજનો બનાવે છે.
- પ્રાથમિક હેલાઇડ સંયોજનો ઓરડાના તાપમાને દ્રાવણમાં દૂંઘળપણું ઉત્પન્ન કરતા નથી.
- આ રીતે લ્યુકાસ કસોટી દ્વારા આલ્કોહોલ સંયોજનોની પરખ કરી શકાય છે.
- લ્યુકાસ કસોટીમાં આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમાંક: $3^\circ > 2^\circ > 1^\circ$

10.

- આલ્ફિનાઇડ અને કીટોન સંયોજનોની હાઇડ્રોજન સાયનાઇડ (HCN) સાથે પ્રક્રિયા કરી સાયનોહાઇડ્રિન સંયોજનો બનાવે છે.
- આ પ્રક્રિયા શુદ્ધ HCN સાથે અતિ દીમી થાય છે.
- આ પ્રક્રિયાને બેદળ વડે ઉદ્દીપિત કરવામાં આવે છે અને ઉત્પન્ન થતો સાયનાઇડ આયન (CN^-) પ્રભળ કેન્દ્રાનુરૂપી પ્રક્રિયક હોવાથી કાર્બોનિલ સંયોજનોમાં ઉમેરાએ અનુવર્ત્તી સાયનોહાઇડ્રિન બનાવે છે.
- સાયનોહાઇડ્રિન ઉપયોગી સાંજ્વિક મધ્યવર્તી સંયોજનો છે.



11.

- કાર્બોહાઇડ્રેટ સંયોજનોને જળવિભાજન દરમાન તેમની વર્તિષૂકના આદારે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમને મુખ્યત્વે નીચેના ગ્રામમાં વહેંચવામાં આવે છે.
- (i) મોનોસેકેરાઇડ સંયોજનો : 'જે કાર્બોહાઇડ્રેટ સંયોજનનું પોલિહાઇડ્રોક્લિસ આલ્ફિનાઇડ અથવા પોલિહાઇડ્રોક્લિસ કિટોનના વધુ સરળ એકમમાં જળવિભાજન કરી શકતું નથી, તેને મોનોસેકેરાઇડ સંયોજનો કહે છે.'
- ⇒ કુદરતમાંથી મળી આવતાં આશારે 20 મોનોસેકેરાઇડ સંયોજનો જાણીતાં છે. તેમાંના કેટલાંક સામાન્ય ઉદાહરણો : ગલુકોગ, કુકટોગ, ડિઝોગ, વગોરે છે.
- (ii) ઓલિગોસેકેરાઇડ સંયોજનો : 'જે કાર્બોહાઇડ્રેટ સંયોજનોના જળવિભાજનથી બેથી દસ મોનોસેકેરાઇડ એકમો મળે છે તેને ઓલિગોસેકેરાઇડ સંયોજનો કહે છે.'
- ⇒ જળવિભાજનથી પ્રાપ્ત થતાં મોનોસેકેરાઇડ એકમોની સંખ્યાના આદારે તેમને ફીથી ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ સંયોજનમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ બધામાં ડાયસેકેરાઇડ અથવા સામાન્ય છે.
- ⇒ ડાયસેકેરાઇડના જળવિભાજનથી મળતાં બે મોનોસેકેરાઇડ એકમો સમાન કે જુદા જુદા હોઈ શકે છે.
- ⇒ ઉદાહરણ તરીકે સુકોગના જળવિભાજનથી ગલુકોગ અને કુકટોગના એક-એક અણુ મળે છે. જ્યારે માલ્ટોગના જળવિભાજનથી માગ ગલુકોગના બે અણુઓ મળે છે.
- (iii) પોલિસેકેરાઇડ સંયોજનો : 'જે કાર્બોહાઇડ્રેટ સંયોજનોના જળવિભાજનથી અતિથેત્ત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ એકમો મળે છે, તેને પોલિસેકેરાઇડ સંયોજનો કહે છે.'
- ⇒ કેટલાંક સામાન્ય ઉદાહરણો રટાર્ચ, સેલ્યુલોગ, ગલાયકોજન, ગુંદર, વગોરે છે. પોલિસેકેરાઇડ સ્વાએ મીઠા હોતા નથી, તેથી તેમને અશર્કરા (non-sugar) પણ કહે છે.

12.

- કાર્બોહાઇડ્રેટ સંયોજનોને રિડ્ક્રુસિંગ શર્કરા (રિડ્ક્રશનકર્તા શર્કરા) અથવા નોન-રિડ્ક્રુસિંગ શર્કરામાં (બિનરિડ્ક્રશનકર્તા શર્કરા) વગ્ાઈની કરી શકાય છે.
- ‘જે કાર્બોહાઇડ્રેટ સંયોજનો ફેહલિંગના દ્રાવણનું અને ટોલેન્સના પ્રક્રિયકર્તાનું રિડ્ક્રશન કરે છે, તેને રિડ્ક્રુસિંગ શર્કરા કહેવાય છે.’ બધા મોનોસેક્રાઇડ સંયોજનો પછી તે આફોગ હોય કે, કિટોઝ હોય તેઓ રિડ્ક્રુસિંગ શર્કરાઓ છે.

બિભાગ B

- નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો : (દરેક પ્રશ્નના 3 ગુણા)

13.

$$\rightarrow w_2 = 25 \text{ g}, M_2 = 180 \text{ g mol}^{-1}, p_1^0 = 17.535 \text{ mm}$$

$$w_1 = 450 \text{ g}, M_1 = 18 \text{ g mol}^{-1}, p_1 = ?$$

$$\rightarrow n_1 = \frac{w_1}{M_1} = \frac{450}{18} = 25 \text{ mol}$$

$$\rightarrow n_2 = \frac{w_2}{M_2} = \frac{25}{180} = 0.1389$$

$$\rightarrow \frac{p_1^0 - p_1}{p_1^0} = \frac{n_2}{n_1 + n_2}$$

$$\rightarrow \therefore \frac{17.535 - p_1}{17.535} = \frac{0.1389}{0.1389 + 25} = 0.00552$$

$$\rightarrow \therefore p_1 = 17.535 - 0.097 = 17.438 \text{ mm Hg}$$

14.

$$\begin{aligned} \rightarrow \Lambda_m^0 \text{ HCOOH} &= \Lambda_m^0 \text{H}^+ + \Lambda_m^0 \text{HCOO}^- \\ &= 349.6 + 54.6 \\ &= 404.2 \text{ S cm}^2 \text{ mol}^{-1} \end{aligned}$$

→ વિયોજન અંશ,

$$\alpha = \frac{\Lambda_m}{\Lambda_m^0} = \frac{46.1}{404.2} = 0.1140$$

→ વિયોજન અયળોક ગણાંદો,

$$K_a = \frac{c \alpha^2}{1 - \alpha} = \frac{0.025 \text{ mol}^{-1} \text{ L} \times (0.114)^2}{1 - 0.114}$$

$$= \frac{3.249 \times 10^{-4} \text{ mol L}^{-1}}{0.886}$$

$$K_a = 3.67 \cdot 10^{-4} \text{ mol L}^{-1}$$

15.

→ Aના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ = x

Bના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ = y હોય, તો

$$\text{પ્રક્રિયાએવા} = k [A]^x [B]^y$$

આથી,

$$r_1 = k (0.20)^x (0.30)^y = 5.07 \times 10^{-5} \dots\dots (i)$$

$$r_2 = k (0.20)^x (0.10)^y = 5.07 \times 10^{-5} \dots\dots (ii)$$

$$r_3 = k (0.40)^x (0.05)^y = 1.43 \times 10^{-4} \dots\dots (iii)$$

સમીકરણ (i)ને (ii) વડે ભાગતાં,

$$\frac{r_1}{r_2} = \frac{k(0.20)^x (0.30)^y}{k(0.20)^x (0.10)^y} = \frac{5.07 \times 10^{-5}}{5.07 \times 10^{-5}}$$

$$\therefore 3^y = 1$$

$$\therefore y = 0 \text{ થાય કારણ કે } 3^0 = 1 \text{ થાય.}$$

સમીકરણ (ii)ને (iii) વડે ભાગતાં,

$$\frac{r_2}{r_3} = \frac{k(0.2)^x (0.10)^y}{k(0.40)^x (0.05)^y} = \frac{5.07 \times 10^{-5}}{1.43 \times 10^{-4}}$$

$$\frac{r_2}{r_3} = \frac{(0.2)^x (0.10)^0}{(0.4)^x (0.05)^0} = 0.3545$$

$$\therefore \left(\frac{1}{2}\right)^x = 0.3545$$

$$\therefore 2^x = \frac{1}{0.3545} = 2.82$$

$$\therefore \log 2^x = \log 2.82 = 0.4503$$

$$\therefore x \times 0.3010 = 0.4503$$


$$\therefore x = \frac{0.4503}{0.3010} = 1.5$$

Aના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ = 1.5

Bના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ = 0




16.

→ પોટેશિયમ ડાયકોમેટ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. એસિડિક માઈમમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 માંથી +3 થાય છે. તેની ઓક્સિડેશનકર્તા તરીકેની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય.





(i) આયોડાઇઝ :

→ $\text{K}_2\text{Cr}_2\text{O}_7$ ના એસિડિક દ્રાવણમાં આયોડાઇઝ આયન (I^-) નું આયોડિન (I_2) માં ઓક્સિડેશન થાય છે.






(ii) આયરન (II) દ્રાવણ :

→ $\text{K}_2\text{Cr}_2\text{O}_7$ ના એસિડિક દ્રાવણમાં ફેરસ આયન (Fe^{2+}) નું ફેરિક આયન (Fe^{3+}) માં ઓક્સિડેશન થાય છે.




(iii) H_2S :

→ $K_2Cr_2O_7$ ના એસિડિક દ્રાવણમાં H_2S નું સલ્ફરમાં ઓક્સિડેશન થાય છે.





17.


- જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ સીધો ભોડાયેલો હોય તેને β -કાર્બન પરમાણુ કહે છે અને આ કાર્બનની પાસેના કાર્બનને β -કાર્બન કહે છે.
- “જ્યારે β -હાઈડ્રોજનયુક્ત હેલોઓલ્કેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલીચ દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો β -કાર્બન પરથી હાઈડ્રોજન પરમાણુનું અને α -કાર્બન પરમાણુ પરથી હેલોજન પરમાણુનું વિલોપન થાય છે.”






- $B =$ બેઝ, $X =$ અવાશિષ સમૂહ
- પણામે નીપણ તરીકે એક આલ્કીન સંયોજન બને છે.
- જોકે, આ વિલોપનમાં β -હાઈડ્રોજન પરમાણુ સંકળાયેલો હોવાથી તેને સામાન્ય રીતે β -વિલોપન પણ કહે છે.



- જ્યારે એક કરતાં વધુ β -હાઈડ્રોજન પરમાણુનો પ્રાણી હોવાના કારણે એક કરતાં વધુ આલ્કીન બનવાની સંભાવના હોય ત્યારે સામાન્ય રીતે એક આલ્કીન મુખ્ય નીપણ તરીકે બને છે, જે સૌપ્રથમ રશિયન રસાયણવિજ્ઞાની એલેક્ટ્રેન્ડ જેટસેવે (જેનું જેટ્સેક્ટ્યુની પણ ઉત્ત્યારણ થાય છે) નોંધી. તેમણે 1875માં એક નિયમ પ્રસ્તાવિત કર્યો, “ડિહાઇડ્રોહેલોજનનીકરણ પ્રક્રિયામાં મુખ્ય નીપણ તરીકે એવો આલ્કીન મળે છે કે, જેમાં ડિનંદને ભોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કોહોલ સમૂહો ભોડાયેલા હોય.”
- આમ, 2-બ્રોમેપૈન્ટન મુખ્ય નીપણ તરીકે પેન્ટ-2-ઇન આપે છે.




18.




19.

→ ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે બોડાયેલો હોય તેવાં આટિલાઇટ અને કીટોન સંયોજનો (મિથાઇલ કીટોન સંયોજનો) સોડિયમ હાઇપોલાઇટ દ્વારા અનુવર્ત્તી કાર્બોક્સિલિક ઓક્સિડના સોડિયમ ક્ષારમાં ઓક્સિડેશન પામે છે, જે મૂળ કાર્બોનિલ સંયોજન કરતાં એક કાર્બન પરમાણુ ઓછો ધારાવે છે.



→ અંદી મિથાઇલ કીટોન સંયોજનમાંનો મિથાઇલ સમૂહ હેલોક્ષેપ્ટમાં રૂપાંતર પામે છે.

→ જો મિથાઇલ કીટોન સંયોજનના મૂળ અણુમાં કાર્બન-કાર્બન ડિબંધ હાજર હોય તો પણ ઓક્સિડેશન પર તેની કોઈ અસર થતી નથી. દા.ત. નીચેની પ્રક્રિયા...



→ સોડિયમ હાઇપોઆયોડાઇટ દ્વારા આયાડોક્ષેપ્ટ પ્રક્રિયા CH_3CO સમૂહ અથવા $\text{CH}_3\text{CH}(\text{OH})$ સમૂહની પરખ માટે પણ ઉપયોગી થાય છે, જે ઓક્સિડેશન દ્વારા CH_3CO સમૂહ બનાવે છે.


20.

→ આટકાઇલ અથવા બેન્જાઇલ હેલાઇટ સંયોજનમાં કાર્બન-હાઇડ્રોજન બંધ કેન્દ્રાનુરૂપાણી પ્રક્રિયક દ્વારા સરળતાથી તૂટી શકે છે.


→ આટકાઇલ અથવા બેન્જાઇલ હેલાઇટ, એમોનિયાના દાયેનોલોટીય દ્રાવણ સાથે કેન્દ્રાનુરૂપાણી વિસ્થાપન પ્રક્રિયા કરે છે, જેમાં હાઇડ્રોજન પરમાણુ એમિનો ($-\text{NH}_2$) દ્વારા વિસ્થાપન પામે છે. એમોનિયા અણુ દ્વારા $\text{C}-\text{X}$ બંધ તૂટવાની પ્રક્રિયા એમોનોલિસીસ તરીકે ઓળખાય છે.

→ આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે બંધ કરેલી કાચની નળીમાં 373 K તાપમાને કરવામાં આવે છે.

→ આ રીતે પ્રાત પ્રાથમિક એમાઇન કેન્દ્રાનુરૂપાણી પ્રક્રિયકની જેમ વર્તે છે અને ફરીથી તે આટકાઇલ હેલાઇટ સાથે પ્રક્રિયા કરી દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો અને છેવટે ચતુર્થક એમોનિયમ ક્ષાર બનાવે છે.



→ એમોનિયમ ક્ષારની પ્રભા બેદ્ધ સાથેની પ્રક્રિયાથી નીચે મુજબ મુક્ત એમાઇન મેળવી શકાય છે :




→ એમોનોલિસીસની પ્રતિકૂળતા એ છે કે તે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષારનું મિશ્રણ આપે છે.

→ આ પ્રક્રિયામાં વધુ પડતા એમોનિયાનો ઉપયોગ કરવાથી મુખ્ય નીપણ તરીકે માત્ર પ્રાથમિક એમાઇન મળે છે.


→ આ પ્રક્રિયા માટે હેલાઇટ સમૂહોની એમાઇન સંયોજનો સાથેની પ્રતિક્રિયાભક્તતાનો ક્રમ $\text{RI} > \text{RBr} > \text{RCI}$ છે.

21.

- नाइट्रोजन संयोजनो लिथियम एल्युमिनियम हाइड्राइड (LiAlH_4) अथवा उद्धीपकीय हाइड्रोजनीकरण द्वारा रिक्षक्षण पामीने प्राथमिक ऐमाइन संयोजनो बनावे छे. आ प्रक्रिया चाटती ऐमाइन श्रेणी एटले के प्रारंभिक ऐमाइन संयोजन करतां एक वधु कार्बनावाटा ऐमाइन संयोजननी बनावटमां उपयोगी थाय छे.



- ऐमाइन संयोजनो लिथियम एल्युमिनियम हाइड्राइड द्वारा रिक्षक्षण पामीने ऐमाइन संयोजनो बनावे छे.



बिभाग C

- नीचे आपेला प्रश्नोना माझ्या मुजब उत्तर आपो : (दरेक प्रश्नां ४ गुण)

22.

→ “कोई पण तापमाने द्रावणे सांदर्भाना समग्र गाळा दरमियान राउल्टना नियमनुं पालन न कर्ते तो तेमने निनआदर्श द्रावण कठेवामां आवे छे.”

→ जिन आदर्श द्रावणमां अंने घटक प्रवाही होय तो घटकोनुं कुल कद अंने घटकना कदना सरवाताथी वधावे अथवा ओळुं होई शाके. आथी $\Delta_{\text{mix}}V \neq 0$

→ निनआदर्श द्रावण माटे $\Delta_{\text{mix}}H \neq 0$ एटले के बे घटकोने भिन्न करतां उभानुं उत्तर्जन के शोषण थाय छे.

→ निनआदर्श द्रावणमां A-B आंतरावातीव आकर्षणी A-A अने B-B आंतरावातीव आकर्षणी करतां वधु के ओळुं जोवा मने छे.

→ उदाहरण : धयेनोल, ऐसिटेन, CS_2 अने CH_3COCH_3 , CHCl_3 अने CH_3COCH_3

→ राउल्टना नियमथी धन विचलन

⇒ “जे द्रावणानुं कुल बाघदबाण राउल्टना नियम अनुसार नक्की करेल बाघदबाण करतां वधु आवे, तो तेने राउल्टना नियमथी धनविचलन कहे छे.”

⇒ जे द्रावण राउल्टना नियमथी धनविचलन दशावे त्यारे $\Delta_{\text{mix}}H > 0$

⇒ धन विचलन थाय, त्यारे द्रावण माटे, $\Delta_{\text{mix}}V > 0$ थाय.

⇒ राउल्टना नियमथी धन विचलननी बाबतमां A-B पारस्परिक क्रियाओ A-A अथवा B-B करतां नवाली होय छे.


⇒ आनो अर्थे ऐम थाय के आवा द्रावणोमां (A अथवा B)ना अणुओ शुद्ध अवस्था करतां वधु सरगताथी छटकी शक्शे.

⇒ जे बाघदबाणमां वधारो करशे अने धन विचलनमां परिणमशे.

⇒ धयेनोल अने ऐसिटेनना भिन्नण आ रीते वर्ते छे.


⇒ शुद्ध धयेनोलमां अणुओ हाइड्रोजनबंधित होय छे. ऐसिटेन उमेरवाथी तेना अणुओ यजमान अणुओनी वर्चे गोठवाय छे अने तेमनी वर्चेना केटलाक हाइड्रोजन अंदी तोडी नांभे छे.

⇒ पारस्परिक क्रिया नवाली थवाने लीघे द्रावण राउल्टना नियमथी धन विचलन दशावे छे.




राउल्टना नियमथी धनविचलन दशावतुं द्रावण

- રાઉલ્ટના નિયમથી અધણ વિચલન
 - “જો દ્રાવણનું કુલ બાધદબાળ રાઉલ્ટના નિયમ અનુગ્રાંત નક્કી કરેલા બાધદબાળ કરતાં ઓછું આવે તો તેને રાઉલ્ટના નિયમથી અધણ વિચલન કહે છે.”
 - જો દ્રાવણ રાઉલ્ટના નિયમથી અધણવિચલન દરશાવે ત્યારે $\Delta_{\text{mix}}H < 0$
 - જો દ્રાવણ અધણ વિચલન દરશાવે ત્યારે દ્રાવણ માટે $\Delta_{\text{mix}}V < 0$ થાય.
 - રાઉલ્ટના નિયમથી અધણ વિચલનના કિસ્સામાં A-A અને B-B વચ્ચેનાં આંતરાએવીય આકર્ષણ બળો A-B વચ્ચેના આંતરાએવીય આકર્ષણ બળો કરતાં વધુ નભાય હોય છે જેને લીધે બાધદબાળમાં ઘટાડો થાય છે. જેને પરિણામે અધણ વિચલન થાય છે.
 - ફીનોલ અને એનીલિનનું મિશ્રણ આ પ્રકારનું ઉદાહરણ છે. આ કિસ્સામાં ફીનોલિક પ્રોટોન અને એનીલિનના નાઇટ્રોજનના અયુઝેમની ધારેક્રોન રૂગ્મ વચ્ચેના આંતરાએવીય હાઇડ્રોજન બંધ, એક જ પ્રકારના અણુઓ વચ્ચેના આંતરાએવીય હાઇડ્રોજન બંધ કરતાં વધુ પ્રબળ હોય છે.
 - કલોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ જે રાઉલ્ટના નિયમથી અધણ વિચલન દરશાવે છે. આનું કારણ એ છે કે કલોરોફોર્મ એસિટોનના આણુઓ હાઇડ્રોજન બંધ રચી શકે છે, જે નીચે દરશાવેલ છે.




- જે ઘટકના આણુઓનું છટકી જવાનું વલણ ઘટાડે છે. જેના પરિણામે બાધદબાળ ઘટે છે અને પરિણામે રાઉલ્ટના નિયમથી અધણ વિચલન દરશાવે છે.





23.


- “જે કોષનો ઉપયોગ કર્યો પછી તેનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીને ફરી પુનર્જીવિત (Recharge) કરી શકાય છે. જેથી તેનો ફરી ઉપયોગ થઈ શકે તેને દ્વિતીયક કોષ કહે છે.”
- સારો દ્વિતીયક કોષ ઘણી બદી ડિસ્ટ્રાઇઝર અને ચાર્જિંગ પ્રક્રિયાઓ કરે છે.
- સોથી અગત્યનો દ્વિતીય કોષ લેડસંગ્રાહક બેટરી ઓટોમોબાઇલ અને ઇન્વર્ટર (પરિવર્તક)માં સામાન્ય રીતે વપરાય છે, જે નીચેની આકૃતિમાં દરશાવિલ છે.



- લેડસંગ્રાહક બેટરીમાં લેડ એનોડ અને લેડની ગ્રીસ (grid) જેના પર લેડ ડાયોક્સાઈડ (PbO_2) ચોંટાડેલો હોય છે, તે કેથોડ તરીકે વર્તે છે.
- 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ વિધુતવિભાજય તરીકે વપરાય છે.
- કોષ જ્યારે ઉપયોગમાં હોય ત્યારે થતી કોષ પ્રક્રિયાઓ નીચે આપેલ છે.



→ એટલે કે, કેથોડ અને એનોડ પ્રક્રિયા ધરાવતી એકંદર પ્રક્રિયા છે.



→ चार्टिंगा करतां माझिया भ्रतिगामी बने छे अने अनोनं परनो अने केंयोंड परनो $PbSO_4(s)$ अनुकूल Pb अने PbO_2 मध्ये पसिवर्तित छे

24.

- મેક્સિક્સ ટ્રોટાન અને વિલિયમ લુધસ ડારા વિકસાવાયેલ સંઘાત સિદ્ધાંત પ્રક્રિયાની ઊર્જાકીય અને ક્રિયાવિધિ બાબતોને ગણનતાપૂર્વક રજૂ કરે છે.

→ આ સિદ્ધાંત વાયુઓના અણુ ગતિવાદ પર આધારિત છે.

આ સિહિંતાનુસાર પ્રક્રિયા અણુઓને સખત ગોળા તરીકે કલપવામાં આવ્યા છે અને અણુઓ જ્યારે એકળીજા સાથે અથડામણ પામે છે ત્યારે પ્રક્રિયા થાય છે તેમ ધારવામાં આવ્યા છે.

→ “પ્રક્રિયા મિશ્રણના એકમ કદમાં પ્રતિસેકન્ડ થતાં સંઘાતની સંખ્યાને અથડામણ આવૃત્તિ(Z) કહે છે.”

→ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતું બીજું પરિબળ સંક્રિયકરણ ઊર્જા છે.

➡ દ્વિ-આણીય પ્રાથમિક પ્રક્રિયા $A + B \rightarrow$ નીપળે માટે પ્રક્રિયાવેગ નીચે મુજબ રજૂ કરી શકાય.

$$\text{ਵੇਗ} = Z_{AB} e^{-\frac{E_a}{RT}} \dots\dots\dots \text{ਸਮੀਕਾਰਣ (1)}$$


જ્યાં Z_{AB} મક્કિયકો A અને Bની સંઘાત આવૃત્તિ છે, તથા $e^{-\frac{E_a}{RT}}$, E_a જેટલી કે, તેવાથી વધારે ઊર્જા ધરાવતું આણુઓનો અંશ છે. સમીકરણ-
(1)ને આહેનિયસ સમીકરણ સાથે સરાવતું કહી શકાય કે, A સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે.

➡ પરમાણુચિય સ્પિસીગ અને સાધા અણુઓ સમાવતી પ્રક્રિયાઓના વેગ અચળાંકના મૂલ્યોનું પ્રાક્રિકથન સમીકરણ (1) દ્વારા અતિચોકસાઈપૂર્વક કરી શકાય છે.

► પરંતુ સંકીર્ણ અણુઓના કિરસામાં નોંધપાત્ર વિચલન ભોવા મળે છે, જેનું કારણ અણુઓના બદા જ સંઘાત નીપજ અણુનું નિમણિ કરતા નથી તે હોઈ શકે.

“એવા સંઘાત કે જેમાં અણુસો પૂર્વટી ગતિજ ઊરી (શ્રેષ્ઠ ઊરી) અને યોગ્ય દિક્ષવિન્યાસ (દિશા) સાથે સંઘાત પામે છે, જેવી પ્રક્રિયા કરતી સ્પિસ્ટિક વરચે બનંતની તાત્કાર અને નવા બન્ધુ (ડ્રાઇવની નીપલેની બનંતની અનકાળ બને છે, તેને અસરકારક (કલાદાયક) સંઘાત કહેલાય છે.”

ઉદાહરણ તરીકે ખ્રોમિયનેમાંથી મિથેનોલની બનાવટ $\text{CH}_3\text{Br} + \text{OH}^- \rightarrow \text{CH}_3\text{OH} + \text{Br}^-$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રક્રિયાએ અણુઓના ડિગ્રીનું વધું હશે.



➡ પ્રક્રિયા અણુઓનો યોગ દિશાએથી થયેલ સંઘાત નીપણ અણુની બંધ રચના તરફ દોડે છે, જ્યારે એચોગ દિશાએથી થયેલ સંઘાત તેમને માત્ર પાછા દાંડે છે અને નીપણ બનતી નથી.

→ અસરાકારક સંઘાતને સમજવા માટે અન્ય સંભાવ્યતા અવયવ અથવા ગ્રિ-વિમચિન્યાસી અવયવ P રજૂ કરાયો હતો, જે યોગ્ય દિક્કિવિન્યાસથી થયેલા આખ્યોના સંઘાતનો સમાવેશ કરે છે.



$$d\sigma = P Z_{AB} e^{-\frac{E_a}{RT}}$$

આમ, સંઘાત સિક્યુરિટીમાં સંક્રિયકરણ ડોઝ અને પ્રક્રિયાએ અણુઓનો યોગ્ય વિક્રિબન્ધાસ બને સાથે મળીને અસરકારક સંઘાતનો માપદંડ આપે છે. જોના કાર્ય રાસાયનિક પ્રક્રિયાનો વેગ નક્કી થાય છે.

25.


- “જે સમઘટકોને સમાન રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન હોય છે, પરંતુ તેમને જુદી જુદી અવકાશીય (spatial) ગોઠવણી હોય તેને અવકાશીય સમઘટકતા કહે છે.”
- ભૌમિતિક સમઘટકતા (Geometric Isomerism) :
 - ⇒ આ પ્રકારની સમઘટકતા હિટરોલેટિક સંકીર્ણોમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીને કારણે ઉદ્ભવે છે.
 - ⇒ આ વર્તેણૂક દર્શાવતાં અગત્યાનાં ઉદાહરણોમાં સવર્ગ આંક 4 અને 6 ધરાવતાં સંચોજનો છે.
- ML_4 પ્રકારના સમતલીય સમચોરસ સંકીર્ણ માટે :

- ⇒ $[MX_2L_2]$ સૂત્ર ધરાવતાં (X અને L એક દંતીય લિગેન્ડ છે) સમચોરસ સંકીર્ણમાં બે લિગેન્ડ X એકબીજાની નજીક સિસ સમઘટકતામાં હોય છે અથવા એકબીજાથી વિરુદ્ધ ટ્રાન્સ સમઘટકમાં હોય છે.



$[\text{Pt}(\text{NH}_3)_2\text{Cl}_2]$ ના ભૌમિતિક સમઘટકો (સિસ અને ટ્રાન્સ)

- ⇒ MABXL પ્રકારના (જ્યાં A, B, X, L એક દંતીય લિગેન્ડ છે) અન્ય સમતલીય ચોરસ સંકીર્ણમાં પ્રણ સમઘટકોમાં બે સિસ અને એક ટ્રાન્સ સમઘટક મળે છે.




- ⇒ આવી સમઘટકતા સમયતુફલકીય ભૂમિતિમાં શક્ય નથી.

- ML_6 પ્રકારના અષ્ટકુલકીય સંકીર્ણ માટે :

- ⇒ અષ્ટકુલકીય રચનામાં જેનું સૂત્ર $[MX_2L_4]$ છે તેમાં શક્ય છે.


- ⇒ આમાં બે X લિગેન્ડ સિસ અથવા ટ્રાન્સ ગોઠવણીમાં એકબીજાને અભિવિન્યસ્તા (oriented) હોય છે. ઉદાહરણ : $[\text{Co}(\text{NH}_3)_4\text{Cl}_2]^+$



$[\text{Co}(\text{NH}_3)_4\text{Cl}_2]^+$ ના ભૌમિતિક સમઘટકો (સિસ અને ટ્રાન્સ)

- ⇒ આ પ્રકારની સમઘટકતા જ્યારે $[MX_2(L-L)_2]$ સૂત્રવાળા સંકીર્ણમાં જ્યારે ડિ-દંતીય લિગેન્ડ L-L [દા.ચ., $\text{NH}_2\text{CH}_2\text{CH}_2\text{NH}_2$ (en)] હાજર હોય છે ત્યારે પણ ઉદ્ભવે છે.


ઉદાહરણ : $[\text{Co}(\text{en})_2\text{Cl}_2]$




$[\text{Co}(\text{en})_2\text{Cl}_2]$ ના ભૌમિતિક (સિસ અને ટ્રાન્સ) સમઘટકો

- ⇒ બીજા પ્રકારની ભૌમિતિક સમઘટકતા $[\text{Ma}_3\text{b}_3]$ પ્રકારના અષ્ટકુલકીય સંકીર્ણ જેવાં કે $[\text{Co}(\text{NH}_3)_3(\text{NO}_2)_3]$ માં ઉદ્ભવે છે.

- જો આષ્ટકુલકની બાજુના પાસપાસેના ખૂણાઓ પર સમાન લિગેન્ડના ગ્રાફ દાતા પરમાળું સ્થાન પ્રાપ્ત કરે છે ત્યારે આપણાને ફેસિયલ (facial-fac) સમઘટક મળે છે.
- જ્યારે તેમના સ્થાન આષ્ટકુલકના ચામ્યોતચીય (meridional)ની આસપાસ હોય છે, ત્યારે મેરિડિયોનલ (meridional-mer) સમઘટક મળે છે.



ફેસ (fac)-




મર (mer)-


$[\text{Co}(\text{NH}_3)_3(\text{NO}_2)_3]$ સંક્રિએમાં ફેસિયલ (fac) અને મેરિડિયોનલ (mer) સમઘટકો

26.

- (a) HCl-ZnCl_2 સાથે :




યુટેન-1-ઓલ



2-મિથાઇલયુટેન-2-ઓલ


2-ક્લોરો-2-મિથાઇલયુટેન

- (b) HBr સાથે :



યુટેન-1-ઓલ


1-ભ્રોમોયુટેન



2-મિથાઇલયુટેન-2-ઓલ


2-ભ્રોમો-2-મિથાઇલયુટેન

- (c) SOCl_2 સાથે :



યુટેન-1-ઓલ

1-ક્લોરોયુટેન



2-મિથાઇલયુટેન-2-ઓલ

2-ક્લોરો-2-મિથાઇલયુટેન

27.

